



GANESH BENZOPLAST LIMITED

CIN: L24200MH1986PLC039836

Regd. Office: Dina Building, 1st Floor, 53, Maharshi Karve Road, Marine Lines, Mumbai - 400 002

Tel: 022- 6140 6000/22001928

Email: compliance@gblinfra.com Website: www.ganeshbenzoplast.com

May 17, 2025

To,

The General Manager, Department of Corporate Services – Corporate Relations Department, BSE Limited, Pheeroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai – 400 001. Scrip ID: 500153	The Manager, Listing Department National Stock Exchange of India Limited Exchange Plaza, 5th Floor, Plot No. C/1, G-Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai – 400051 Scrip ID: GANESHBE
---	---

Dear Sir/Madam,

Sub: Intimation of Publication of Audited Financial Results in Newspapers

Pursuant to Regulation 33, 47 and other applicable Regulations of SEBI (LODR) Regulations, 2015, the Audited Financial Results (Standalone and Consolidated) for the quarter and year ended March 31, 2025 was duly published in the following newspapers:

The Business Standard, Mumbai Lakshadweep & Mumbai Samachar on dated May 15, 2025.

The extracts of the newspapers are enclosed for your reference.


You are requested to take the above information on records and oblige.

Thanking You,

Yours sincerely,
For Ganesh Benzoplast Limited

Ekta Dhanda
Company Secretary & Compliance Officer

Encl: As above



GANESH BENZOPLAST LIMITED

CIN : L24200MH1986PLC039836

Regd. Office : Dina Building, 1st Floor, 53, Maharshi Karve Road, Marine Lines (East), Mumbai 400 002.Tel:022-22001928

e-mail : investors@gblinfra.com web-site : www.ganeshbenzoplast.com

Extract Of Statement Of Audited Standalone And Consolidated Financial Results For The Quarter And Year Ended March 31, 2025

Sr No	Particulars	STANDALONE					CONSOLIDATED				
		Quarter Ended			Year Ended		Quarter Ended			Year Ended	
		31.03.2025	31.12.2024	31.03.2024	31.03.2025	31.03.2024	31.03.2025	31.12.2024	31.03.2024	31.03.2025	31.03.2024
		Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited
1	Total Income From Operations	575.57	550.19	602.47	2,154.01	2,267.15	999.34	892.24	1,462.64	3,743.11	4,770.77
2	Net Profit for the period (before tax and Exceptional items)	243.50	212.85	220.52	861.92	815.73	285.85	242.41	208.96	966.53	839.91
3	Net Profit for the period (before tax and after Exceptional items)	(200.28)	212.85	220.52	418.14	815.73	(161.46)	242.41	208.96	519.22	839.91
4	Net Profit for the period (after tax and after Exceptional items)	(158.58)	161.48	161.90	307.25	606.25	(131.92)	183.89	142.91	380.86	614.41
5	Total Comprehensive Income for the period	(158.13)	153.46	165.38	300.61	609.47	(131.79)	174.42	146.18	373.97	616.86
6	Equity Share Capital(Face value of Re.1/- each)	71.99	71.99	71.99	71.99	71.99	71.99	71.99	71.99	71.99	71.99
7	Reserve excluding Revaluation reserves as shown in the audited balance sheet				5,223.41	4,922.80				5,311.39	4,944.17
8	Earning Per Share (of Re. 1/- each) (not annualised) (after Exceptional items)										
	a) Basic	(2.20)	2.24	2.31	4.27	8.95	(1.83)	2.55	2.03	5.29	9.07
	b) Diluted	(2.20)	2.24	2.31	4.27	8.95	(1.83)	2.55	2.03	5.29	9.07

Notes:


1

The above is an extract of the detailed format of Financial Results for the Quarter and year ended on March 31, 2025 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results are available on the Company's website , www.ganeshbenzoplast.com and and Stock Exchanges website. www.bseindia.com and www.nseindia.com

2

The above financial results have been reviewd and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at their meeting held on May 14, 2025.

By Order of the Board of Directors
For Ganesh Benzoplast Limited
Sd/-
(Rishi Pilani)
Chairman& Managing Director
(DIN 00901627)



PLACE : MUMBAI
DATE:- May 14, 2025

LOST

It is notified that an original bond certificate of India Infrastructure Finance Company Limited. (A Government of India Enterprise), Series: 2A, Certificate No.: 200028, ISIN: INE787H07396; Registered Folio No. IIM0200028; No. of Bonds: 1000 (One Thousand Only), Distinctive No(s): 0000076601-0000076600 issued in favour of Jap Infracon Pvt. Ltd., Mumbai- 400053 has been lost/misplaced. Police complaint has been registered online on 05.05.2025. Finder may send the certificates to the registered office address i.e.,

B -102, TWINKLE APARTMENT, LOKHANDWALA COMPLEX, NEW LINK ROAD, ANDHERI (WEST), MUMBAI- 400053

Date: 15.05.2025
Place: Mumbai

For JAP Infracon Private Limited
Sd/-
Jaikishan Lakhiprasad Bhagchandka
Director

ANDHRA PRADESH GRAMEENA BANK
(A Government undertaking sponsored by Union Bank of India)


TENDER NOTICE

Andhra Pradesh Grameena Bank has floated a Notice Inviting Tender(NIT) for the Staff Group Term Life Insurance Policy for the period from 27-05-2025 to 26-05-2026.
For details visit Bank website www.apgb.bank/tenders.

Place : Guntur, AP.
Date : 14-05-2025

General Manager, H.O., Guntur.
Contact No. 9182564144

Allcargo Logistics Limited
(CIN: L63010MH2004PLC073508)
Regd. Office: 6th Floor, Allcargo House, CST Road, Kalina, Santacruz (East), Mumbai- 400098
Phone: +91 22 66798110
Website: www.allcargologistics.com
Email: investor.relations@allcargologistics.com



BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL,
BENCH, AT MUMBAI

COMPANY SCHEME PETITION CP (CAA) 80/MB/2025

IN

COMPANY APPLICATION NO. C.A.(CAA)/235/MB/2024

IN THE MATTER OF THE COMPANIES ACT, 2013;

AND

IN THE MATTER OF SECTIONS 230 - 232 READ WITH SECTIONS 52 AND 66 AND OTHER APPLICABLE PROVISIONS, IF ANY, OF THE COMPANIES ACT, 2013 READ WITH COMPANIES (COMPROMISES, ARRANGEMENTS AND AMALGAMATIONS) RULES, 2016

AND

In the matter of Composite Scheme of Arrangement between Allcargo Logistics Limited ("Allcargo" or "Transferee Company 2" or "Demerged Company") and Allcargo Supply Chain Private Limited ("Transferor Company 1" or "ASCPL"), a wholly owned subsidiary of the Demerged Company, Gati Express & Supply Chain Private Limited ("Transferor Company 2" or "GESCP"), Allcargo Gati Limited ("Transferee Company 1" or "Transferor Company 3" or "Gati") and Allcargo Worldwide Limited (Formerly known as Allcargo Ecu Limited - change of name w.e.f. May 09, 2025) ("Resulting Company" or "AWL"), a wholly owned subsidiary of the Demerged Company and their respective shareholders (the "Scheme")

Allcargo Logistics Limited
(CIN: L63010MH2004PLC073508), having its registered office at 6th Floor, Allcargo House, CST Road, Kalina, Santacruz (East), Mumbai 400098, Maharashtra, India.

Allcargo Worldwide Limited
(Formerly known as Allcargo Ecu Limited)
CIN: U52220MH2023PLC408966, having its registered office at 6th Floor, Allcargo House, CST Road, Kalina, Vidyanageri, Mumbai 400098, Maharashtra, India.

Allcargo Supply Chain Private Limited
CIN: U45200MH2008PTCT179557 having its registered office at 6th Floor, Allcargo House, CST Road, Kalina, Santacruz (East), Mumbai 400098, Maharashtra, India.

Gati Express & Supply Chain Private Limited
CIN: U62200MH2007PTC390900, having its registered office at 4th Floor, A Wing, Allcargo House, CST Road, Kalina, Santacruz (East), Mumbai City, Mumbai, Maharashtra, India, 400098

Allcargo Gati Limited CIN: L63011MH1995PLC420155, having its registered office at 4th Floor B Wing Allcargo House, CST Road Kalina Santacruz East, Vidyanageri, Mumbai, Maharashtra, India, 400098

... Petitioner Company 1/ First Applicant Company Demerged Company / Transferee Company 2

... Petitioner Company 2/ Second Applicant Company/ Resulting Company

... Petitioner Company 3/ Third Applicant Company/ Transferor Company 1

... Petitioner Company 4/ Fourth Applicant Company/ Transferor Company 2

... Petitioner Company 5 / Fifth Applicant Company/ Transferee Company 1/ Transferor Company 3

NOTICE OF JOINT PETITION

Notice is hereby given that a Joint Petition under Sections 230 to 232 of the Companies Act, 2013 read with Companies (Compromises, Arrangements and Amalgamations) Rules, 2016; for the sanction of Composite Scheme of Arrangement between Allcargo Logistics Limited ("Allcargo" or "Transferee Company 2" or "Demerged Company") and Allcargo Supply Chain Private Limited ("Transferor Company 1" or "ASCPL"), a wholly owned subsidiary of the Demerged Company, Gati Express & Supply Chain Private Limited ("Transferor Company 2" or "GESCP"), Allcargo Gati Limited ("Transferee Company 1" or "Transferor Company 3" or "Gati") and Allcargo Worldwide Limited (Formerly known as Allcargo Ecu Limited) ("Resulting Company" or "AWL"), a wholly owned subsidiary of the Demerged Company and their respective shareholders (the "Scheme") presented by the Petitioners before the Hon'ble National Company Law Tribunal, Mumbai Bench ("NCLT") and was admitted by the Hon'ble NCLT on April 30, 2025. The aforesaid petition is fixed for hearing before the Hon'ble NCLT on July 2, 2025 in the morning at 10:30 or soon thereafter before Bench V of NCLT Mumbai Bench.

If any person concerned is desirous of supporting or opposing the said petition, he/she/they should send to the undersigned Authorized Representative at below mentioned address, the notice of his/her/their intention signed by him/her/them or his/her/their advocate, not later than two days before the date fixed for the final hearing of the Petition. Where any person concerned seeks to oppose the aforesaid petition, the grounds of opposition or a copy of affidavit in that behalf should be furnished with such notice. A copy of the Company Scheme Petition along with all the exhibits will be furnished by the Petitioner's Authorized Representative to any person requiring the same on payment of the prescribed fees for the same.

Dated this 14 May of 2025

Ravi Jakhra
Group Chief Strategy Officer
For Petition Company 1, For Petition Company 2, For Petition Company 3
Tel: +91 22 6679 8110
Email: investor.relations@allcargologistics.com
Registered Address: Allcargo House, 6th Floor, CST Road, Kalina, Santacruz (E), Mumbai - 400 098, Maharashtra, India.

Bhardwaj Pandya
Group Legal Head
For Petition Company 4, For Petition Company 5
Tel: +91 22 6679 8110
Email: investor.services@allcargologistics.com
Registered Address: 4th Floor, Allcargo House, CST Road Kalina Santacruz East, Vidyanageri Mumbai, 400098.

**APPENDIX - 16
NOTICE**

SHRI. SHRIKANT PARSHURAM MULYE was the member of the SHIV SADHANA CO-OP. HSG. SOC. LTD., having address at Hutatma Chaphekar Bandhu Marg, Mulund (East), Mumbai – 400 081 and holding Flat No. A/102 in the building of the Society. SHRI. SHRIKANT PARSHURAM MULYE died on 21/03/2025 without making any nomination.

The society hereby invites claims or objections from the heir or heirs or other claimants/objector or objectors to the transfer of the said shares and interest of the deceased member in the capital/property of the society within a period of 14 days from the publication of this notice, with copies of such documents and other proof in support of his/her/their claims/objections for transfer of shares and interest of the deceased member in the capital/property of the society. If no claims/objections are received within the period prescribed above, the society shall be free to deal with the shares and interest of the deceased member in the capital/property of the society in such manner as is provided under the by-laws of the society. The claims/objections, if any, received by the society for transfer of share and interest of the deceased member in the capital/property of the society shall be dealt with in the manner provided under the bye-laws of the society. A copy of the registered by-laws of the society is available for inspection by the claimants/objectors in the office of the society/with the secretary of the society on Saturday morning 11.00 A.M. to 12.00 P.M. from the date of publication of the notice till the date of expiry of its period.

Place: Mumbai
Date: 15/5/2025

For and on behalf of
SHIV SADHANA CO-OP.
HSG.SCTY.LTD.,
Hon. Secretary

PUBLIC NOTICE

Notice is hereby given that the Certificates for the under mentioned Equity Shares of Control Print Limited, C-106, Hind Saurashtra Industrial Estate, Andheri-Kurla Road, Marol Naka, Andheri (East), Mumbai 400059 have been lost / misplaced and the holder Geeta Holani of the said Equity Shares have applied to the Company to issue duplicate Share Certificates.

Any person who has a claim in respect of the said Shares should lodge the same with the Company at its Registered Office within 21 days from this date 15 May 2025 else the Company will proceed to issue duplicate certificates to the aforesaid applicant without any further intimation. **Folio No: 0211662**

No of Shares	Distinctive Nos	Certificate Nos
	From	To
100	1921001	1921100
100	2151301	2151400
100	2318001	2318100
100	2352901	2353000
100	2354201	2354300
100	2421001	2421100
100	2422801	2422900
100	2443301	2443400
100	2510901	2511000
100	2563301	2563400
100	2932401	2932500
100	2948701	2948800
100	3154401	3154500
100	3393601	3393700
100	3393701	3393800
100	3400701	3400800
100	3521201	3521300
100	3544001	3544100
100	3628101	3628200
100	3686201	3686300
100	3758401	3758500
100	3768701	3768800
1100	10575826	10576925

Name of Shareholder: Geeta Holani **Date:** 15/05/2025
Name and Registered Office address of Company: Control Print Limited, C-106, Hind Saurashtra Industrial Estate, Andheri-Kurla Road, Marol Naka, Andheri (East), Mumbai, Maharashtra 400059


LOST

It is notified that an original bond certificate of India Infrastructure Finance Company Limited (A Government of India Enterprise), Series: 2A, Certificate No.: 200029, ISIN: INE787H07396; Registered Folio No. IIM0200029; No. of Bonds: 1000 (One Thousand Only), Distinctive No(s): 0000076601-0000076600 issued in favour of Jap Overseas Pvt. Ltd., Mumbai- 400053 has been lost/misplaced. Police complaint has been registered online on 05.05.2025. Finder may send the certificates to the registered office address i.e.,

B -102, TWINKLE APARTMENT, LOKHANDWALA COMPLEX, NEW LINK ROAD, ANDHERI (WEST), MUMBAI- 400053

Date: 15.05.2025
Place: Mumbai

For JAP Overseas Private Limited
Sd/-
Jaikishan Lakhiprasad Bhagchandka
Director



APAR Industries Limited
(CIN : L91110GJ1989PLC012802)
Registered Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.
Tel. No. : (0265) 6178700, 6178709, 2339906 E-mail : com.sec@apar.com URL : www.apar.com

EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS
FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2025

₹ in crore

Particulars	Consolidated Results			
	Quarter ended		Year ended	
	31.03.2025	31.03.2024	31.03.2025	31.03.2024
	Audited	Audited	Audited	Audited
Total Income from operations	5,209.76	4,455.11	18,581.21	16,152.98
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	340.09	321.61	1,105.76	1,106.46
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	340.03	321.62	1,105.64	1,105.85
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	249.97	236.22	821.30	825.11
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	263.03	212.45	829.47	806.14
Equity Share Capital	40.17	40.17	40.17	40.17
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as on 31st March	--	--	4,463.37	3,836.26
Earnings Per Share (Face Value of ₹ 10/- each) (for continuing and discontinued operations)				
Basic and Diluted (in ₹)	62.23	60.97	204.47	212.10

Notes:

1)

The said Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 14th May 2025.

2)

Additional information on Standalone financial results is as follows :

₹ in crore

Particulars	Quarter ended		Year ended	
	31.03.2025	31.03.2024	31.03.2025	31.03.2024
	Audited	Audited	Audited	Audited
Total Income from Operations	4,980.63	4,225.59	17,552.26	15,109.28
Profit before tax	332.47	322.30	1,072.82	1,099.41
Profit for the period	244.27	238.44	793.67	823.28
Total Comprehensive income (after tax)	258.05	214.16	798.56	802.33


3)

The above is an extract of the detailed format of Statement of standalone and consolidated financial results filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statement of standalone and consolidated financial results are available on the Stock Exchange websites www.bseindia.com (Scrip Code - 532259) and www.nseindia.com (Scrip Symbol - APARINDS) and on Company's website at the weblink : https://apar.com/wp-content/uploads/2025/05/Outcome-of-Board-Meeting_Results-fy25.pdf


4)

The same can be accessed by scanning the QR Code provided below.

For APAR Industries Limited
Sd/-
Kushal N. Desai
Chairman & Managing Director
DIN : 00008084



Place : Mumbai
Date : 14th May, 2025



APNA SAHAKARI BANK LTD.
(Multi State Scheduled Bank)

Regd. Office :- Apna Bazar, 106-A, Naigaon, Mumbai - 400 014.
Corporate Office :- Apna Bank Bhavan, Dr. S. S. Rao Road, Parel, Mumbai - 400 012.
Tel :- 022-24164860 / 2410 4861-62/2411 4863
Fax 022-24104680 Email :- corporateoffice@apnabank.co.in,
Website :- www.apnabank.co.in

PUBLIC NOTICE FOR SALE

Sale of Immoveable Secured Assets on "As is where is and whatever there is" basis in Terms of the Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI Act) read with the Security Interest (Enforcement) Rules 2002.

Name	Property Description	Outstanding	Reserve Price	Earnest Money Deposit	Bid Increase Amount
M/s. Nyasa Enterprises. – Mr. Sandeep Lalchand Bhansali. (Partner / Mortgage), Mrs. Reena Sandeep Bhansali. (Partner / Mortgage), Mrs. Gurpreet Kaur Bilku. (Guarantor), Mr. Upendra Manohar Wadekar. (Guarantor)	Residential Premises at Flat No. 2104, 21st Floor, C Wing, Tierra CHS. Casa Univis, Loda Splendor, Bhayandar Pada, Thane West – 400 615 (Admesuring Carpet Area 838 Sq. Ft.)	Rs.8,91,60,972.38 (Rupees Eight Crore Ninety One Lakh Sixty Thousand Nine Hundred Seventy Two and Paise Thirty Eight Only) as on August 31st,2023	Rs. 80,60,000/-	Rs. 8,06,000/-	Rs. 1,00,000/-

TERMS & CONDITIONS

* Statutory Dues such as Property Taxes, Sales Tax, Excise Dues, Cess Charges, Charges for documents, transfer fee, Conveyance, Stamp Duty, Registration Fee, etc., If any shall be borne by the Successful Tenderer Alone

1.

Sale is strictly subject to the terms & condition incorporated in this advertisement and the prescribed Tender Document and the SARFAESI Act read with the Security Interest (Enforcement) Rules,2002. Tender forms can be obtained from Apna Sahakari Bank Ltd. Apna Bank Bhavan, Dr. S.S.RAO Road, Parel, Mumbai-400012, upto **27.05.2025 between 11.00 a.m. To 5.00 p.m.** from Monday to Friday.

2.

Inspection: **On 21.05.2025 from 11.00 am to 5.00 p.m.** After due intimation to and confirmation from Apna Sahakari Bank Ltd. It is to be noted that not more than one inspection per Tenderer will be permitted .

3.

The interested bidders shall submit their EMD 10 % of Reserve Price through NEFT/ RTGS before **05.00 PM on 29.05.2025** in the Account no. 002999200000032 Sale of property under SARFAESI Act account of M/s. Nyasa Enterprises For Account with Apna Sahakari Bank Ltd., Head Office, Parel Mumbai -12 : IFSC Code :ASBL0000002. Please note that the Cheques/ Demand Draft shall not be accepted as EMD amount.

4.

Tenders will be opened at **5.00 p.m. On 30.05.2025** at Apna Bank Bhavan, Dr. S. S. Rao Road, Parel, Mumbai - 400 012 when the tenderer may remain present and if necessary raise their offer. Unsuccessful tenderer will not get any interest on EMD.

5.

The borrower / Guarantor(s) may, if desired, also participate in the tender process for the secured assets subject to compliance of the terms and conditions contained herein and in the tender document.

6.

The successful bidders/offers should deposit 25% of the bid amount immediately by the next day or such extended time permitted by the Authorised Officer & balance within 15 days from the date of opening the tender.

7.

If the successful bidders fail to pay the balance 75% of the bid amount within 15 days from the date of opening to offer or such extended time permitted by the Authorised Officer in cash or DD or by RTGS/NEFT, the deposited amount should be forfeited.

8.

Authorised officer has the absolute right to accept or reject any or all offer(s) or adjourn / postpone /cancel the auction without assigning any reason thereof.

9.

After opening the tenders, the intended bidders may be given an opportunity at the discretion of the Authorised Officer to have inter- se bidding among themselves to enhance offer price.

10.

Inspection of the properties will be permitted at site on date & time mentioned above.

11.

This is also notice to the Borrower / Guarantors of the aforesaid loan in respect of the sale of the above mentioned secured assets.

12.

To the best of knowledge of the Authorised Officer, encumbrances or other charges over the property put to sell are not known. However, the intending bidders should independently enquire get satisfied about the charges, right and claims, authority, debt etc. affecting the property.

Note :-

Authorised Officer of Apna Sahakari Bank has taken physical possession under sub section rule 14 of Sarfaesi Act 2002.


For details of the property, tender forms and terms and conditions, please call at 24104861, 24104862, 24112065 Ext.108,109,111. Mob no. 9220506835

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER SARFAESI ACT, 2002

The borrowers/ guarantors are hereby notified that provision of Sub Section 8 of Sec, 13 of SARFAESI Act they are entitled to redeem the securities by paying the outstanding dues / costs/ charges and expenses at any time within 15 days from the date of publication of this auction notice, failing which the property will be auctioned / sold and the balance dues, if any, will be recovered with interest and cost,

Date : 15.05.2025
Place: Thane

Sd/-
Authorized Officer,
Apna Sahakari Bank Ltd.



Regd. Office: ICICI Bank Limited, ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodra, Gujarat. Pin- 390 007
Corporate Office: ICICI Bank Towers, Bandra- Kurla Complex, Bandra (E), Mumbai- 400 051
Regional Office: ICICI Bank Limited, NBCC Place, Pragati Vihar, New Delhi- 110 003

PUBLIC NOTICE – E-AUCTION FOR ASSIGNMENT OF FINANCIAL ASSETS

In terms of the policy of ICICI Bank Limited ("ICICI Bank") on Transfer of Stressed Loans and in line with the regulatory guidelines, ICICI Bank hereby invites EOI from interested Scheduled Commercial Banks/ Small Finance Banks/ARCs/NBFCs/Is for purchase of two Non-Performing Asset ("Financial Assets") on the terms and conditions indicated herein under "Swiss Challenge Method". It is hereby clarified that confirmation of the name of successful bidder will be subject to final approval by the competent authority of ICICI Bank

Base Bid Price	Term of sale	Minimum Mark up
₹ 55.0 million	100% Cash basis	5.00% on Base Bid

Schedule for E-Auction:

Sr. No.	Activity	Date & Time
1	Submission of Expression of Interest ("EOI")	May 19, 2025 latest by 5:00 P.M.
2	Execution of Non-Disclosure Agreement ("NDA") (if not already executed with ICICI Bank)	May 21, 2025 latest by 4:00 P.M.
3	Release of Offer Document along with Preliminary Information Memorandum ("PIM")	By May 21, 2025
4	Access to data room for due diligence	May 22, 2025 to June 05, 2025
5	Submission of Bid Form	June 06, 2025 latest by 5:00 P.M.
6	Process of e-bidding	June 09, 2025 From 11:00 A.M. to 12:00 P.M. with auto extension of five minutes till sale is completed

TERMS & CONDITIONS

1.

The auction for the Financial Assets is under "Swiss Challenge Method", based on an existing offer in hand, who will have the right to match the highest bid. In case no bid is received which crosses the minimum mark up, Base Bid will be designated as the winning bid if it qualifies as per terms and conditions stipulated.

2.

The sale of aforesaid Financial Asset(s) is on "As is Where is Basis", "As is What is Basis", and "Without Recourse Basis".

3.

The e-bidding process, if required, will be conducted through M/s e-Procurement Technologies Ltd (Auction tiger) on the website of auction agency i.e. <https://icicibank.auctiontiger.com> as detailed above.

4.

The e-bidding process shall be subject to terms & conditions contained in the offer document which will be made available to Parties post execution of NDA.

For any further clarifications with regard to data room, terms and conditions of the auction, kindly contact Mr. Ishan Gupta (8879769679) and for submission of EOI/Bids, email at ishan.gupta@icicibank.com, anshu.j@icicibank.com or send by post to Mr. Ishan Gupta at ICICI Bank Limited, NBCC Place, Bhisma Pitamah Marg, New Delhi- 110 003.

ICICI Bank will not be responsible/liable in case of non-receipt of EOI by ICICI Bank for the reasons beyond the control of the Bank. Interested Parties are expected to take efforts to find out the status of communication sent by them to ICICI Bank to ensure their participation in the auction process.

This notice and contents hereof are subject to any prevailing laws, rules and regulations of India.

Date : May 15, 2025
Place : Mumbai

SD/-
Authorised Signatory
For ICICI Bank Limited



अपना बँक
अपना सहकारी
(Multi State Scheduled Bank)

अपना सहकारी बँक लि.

(Multi State Scheduled Bank)

बौंद, कार्यालय: अपना बाजार, १०६-१, नयागाव, मुंबई ४०००१४.
कॉर्पोरेट कार्यालय: अपना बँक भवन, डॉ. एस. एस. राव रोड, परेल, मुंबई - ४०००१२.
दूर: ०२२-२४१६४८६० / २४१० ४८६१-६२/२४११ ४८६३
फॅक्स:- ०२२-२४१० ४८६० ईमेल :- corporateoffice@apnabank.co.in
वेबसाईट:- www.apnabank.co.in

विक्रीची जाहीर सूचना

सिक्क्युरिटी इंटरस्ट (एफ्कोसेमेन्ट) नियमन २००२ सह वाचवायच्या सिक्क्युरिटीयक्सेशन ऑफ रिकन्स्ट्रक्शन ऑफ फायनान्शियल असेट्स आणि एफ्कोसेमेन्ट ऑफ सिक्क्युरिटी इंटरस्ट कायदा, २००२ (सरफैसी कायदा) नुसार स्थावर तारण मालमत्तांची “जसे आहे जेणे आहे आणि तेथे जे आहे” तत्वावर विक्री.

नाव	मालमत्तेचे वर्णन	थकबाबी	राखीव किंमत	इसारा रक्कम अनामत	बोली विस्तार रक्कम
मे. न्यासा एन्टरप्राइजेस - श्री. संदीप लालदेव भंसाळी (भागीदार/गणराज्यदार), सौ. रीना संदीप भंसाळी (भागीदार/गणराज्यदार), सौ. गुरप्रीत कौर बिल्लू (जामीनदार), श्री. उषेंद्र मनोहर वाडेकर (जामीनदार)	सदनिका क्र. २१०४, २१ वा मजला, सी व्हिंग, टिएरा सीएचएफ काचा युनिव्हिर्स, लोदा स्लॅबॅडोरा, भाईंदर पाला, ठाणे पश्चिम - ४०० ६१५ (मोजमाप कॉर्पोरेट क्षेत्रफळ ३८८.५० चौरस फीट) ही निवासी जागा.	दि. ३१ ऑगस्ट, २०२३ रोजी नुसारची रक्कम रु. ८१,६०,९७२.३८ (रुपये अठरा कोटी एकाश्याव लाख साठ हजार नऊशे बाहतर वा पैसे अडीसहा मात्र)	रु. ८०,६०,०००/-	रु. ८०,६०,०००/-	रु. १,००,०००/-

अटी आणि शर्ती

- मालमत्ता वर, विक्री कर, उत्पादन शुल्क, उपकर शुल्क, दस्तावेजांचे शुल्क, हस्तांतरण शुल्क, अभिहस्तांतरण, मुद्रांक शुल्क, नोंदणी शुल्क इ. जर असल्यास, यांसारखी वैधानिक देणी यशस्वी निविदाकाराने एकट्याने भरावयाची आहेत.
- विक्री काटेकोरपणे सदर जाहिरात आणि विहीत निविदा दस्तऐवज आणि सिक्क्युरिटी इंटरस्ट (एफ्कोसेमेन्ट) नियमन २००२ सह वाचवायच्या सरफैसी कायद्यामध्ये समाविष्ट अटी आणि शर्तीच्या अधीन आहे. निविदा अर्ज अपना सहकारी बँक लि., अपना बँक भवन, डॉ. एस. एस. राव रोड, परेल, मुंबई - ४०००१२ येथून सोमवार ते शुक्रवार दि. २७.०५.२०२४ पर्यंत स. ११.०० ते सां. ५.०० या वेळेत प्राप्त करता येतील.
- पाहणी: अपना सहकारी बँक लि.ला योग्य सूचना दिल्यावर आणि त्यांच्या मंजूरिंतर दि. २९.०५.२०२४ रोजी स. ११.०० ते सां. ५.०० पर्यंत. नोंद घ्यावी की, प्रत्येक निविदाकारास एका पेसा जास्त पाहणी करण्याची परवानगी मिळणार नाही.
- इच्छुक बोलीदारांनी त्यांची राखीव किमतीच्या १०% ईएमडी खाते क्र. ००२९९९२००००००३२ सरफैसी कायद्यांतर्गत मालमत्तेची विक्री, मे. न्यासा एन्टरप्राइजेस यांच्या खात्यामध्ये, अपना सहकारी बँक लि. मुख्य कार्याल, परेल मुंबई - १२ यांच्याकडील खात्याकरिता : आयएफएससी कोड: ASBL0000002 येथे दि. २९.०५.२०२४ रोजी सां. ०५.०० पूर्वी एनईएफटी/आरटीएस द्वारे भरावी. कृपया नोंद घ्यावी की, ईएमडी रक्कम म्हणून धनार्ह/धनार्ह स्वीकारण्यात येणार नाही.
- निविदा दि. ३०.०५.२०२४ रोजी सां. ५.०० वातात अपना बँक भवन, डॉ. एस. एस. राव रोड, परेल, मुंबई - ४०००१२ येथे उघडण्यात येतील, जेव्हा निविदाकार उपस्थित राहू शकतात आणि आवश्यकता असल्यास त्यांचे प्रस्ताव वाढवू शकतात. अयशस्वी निविदाकारांना इसारा देवीवर कोणतेही व्याज मिळणार नाही.
- कर्जदार/जामीनदार देखील, इच्छुक असल्यास, येथे आणि निविदा दस्तऐवजामध्ये समाविष्ट अटी आणि शर्तीच्या अनुपालनाच्या अधीन राहून, तारण मालमत्तेकरिता निविदा प्रक्रियेमध्ये सहभागी होऊ शकतात.
- यशस्वी बंधनदार/प्रस्तावदारांचे बोली रकमेच्या २५% पुढील दिवशी किंवा प्राधिकृत अधिकार्याद्वारे मंजूर केलेल्या विस्तारित वेळेपर्यंत ताबडतोब आणि शिल्लक निविदा उघडण्याच्या दिनांकापासून १५ दिवसांमध्ये जमा करावयाची आहे.
- जर यशस्वी बोलीदार प्रस्ताव उघडण्याच्या दिनांकापासून १५ दिवसांमध्ये किंवा प्राधिकृत अधिकार्याद्वारे मंजूर केलेल्या विस्तारित वेळेपर्यंत रोक किंवा डीडी द्वारे किंवा आरटीएस/एनईएफटीद्वारे बंधन करणारा अयशस्वी ठरल्यास, जम केलेली रक्कम जप्त करण्यात येईल.
- प्राधिकृत अधिकार्याने कोणतेही कारण न दर्शविता कोणताही किंवा सर्व प्रस्ताव स्वीकारण्याचे किंवा फेटाळण्याचे किंवा लिलाव स्थगित करण्याचे/पुढे ढकलण्याचे/रद्द करण्याचे संपूर्ण अधिकार आहेत.
- निविदा उघडल्यानंतर, इच्छुक बोलीदारांना प्राधिकृत अधिकार्याच्या अखत्यारीमध्ये प्रस्ताव किंवा वाढविण्याकरिता त्यांच्यामध्ये अंतर्गत बोली लावण्याची संधी देण्यात येईल.
- वर उल्लेखित दिनांक आणि वेळेस मिळकतीची पाहणी करण्याची परवानगी देण्यात येईल.
- वरील नमुद केलेल्या सुरक्षित मालमत्तेच्या विक्रीसंदर्भात उपरोक्त कर्जाच्या कर्जदारांना / जामीनदारांना देखील ही सूचना देखील आहे.
- प्राधिकृत अधिकार्याच्या सर्वोत्तम ज्ञानानुसार, विक्रीस देवलेल्या मालमत्तेवरील बोजे किंवा इतर प्रभाव माहित नाहीत. तथापि, इच्छुक बोलीदारांनी मालमत्तेस बाधित करणारे प्रभाव, हक्क आणि दावे, अधिकार, झगडे इ. बाबत समाधान करून घेणारी चौकशी करावी.

टीप: अपना सहकारी बँकेच्या प्राधिकृत अधिकार्यांनी सरफैसी कायदा २००२ च्या उप कलम नियम १४ अन्वये प्रत्यक्ष नावा घेतला आहे.

मालमत्तेचा अधिक तपशील, निविदा अर्ज आणि अटी आणि शर्ती याकरिता कृपया २४१०४८६१, २४१०४८६२, २४१२०२६५ विस्तार १०८, १०९, १११, मोबा. क्र. ९२२०५०६८३५ येथे संपर्क करावा.

सरफैसी कायदा, २००२ अन्वये वैधानिक १५ दिवसांची विक्री सूचना

कर्जदार/जामीनदारांना याद्वारे सूचित करण्यात येते की, सरफैसी कायद्याच्या कलम १३ च्या उप कलम ८ च्या तरतुदीनुसार ते सदर लिलाव सूचनेच्या प्रसिद्धीच्या दिनांकापासून १५ दिवसांच्या आत कोणत्याही वेळेस थकीत देणी/शुल्क/प्रभाव आणि खर्चाचा भरण करून तारण मालमत्ता सोडविण्यास हक्कदार आहेत.

दिनांक: १५.०५.२०२४

ठिकाण: ठाणे

सही/-

प्राधिकृत अधिकारी,

अपना सहकारी बँक लि.

PUBLIC NOTICE

This is to inform the Public at large that my client **MRS. MARY PAUL ARANHA** is in use and occupation of Flat No.210, Second Floor, Wing -A, EL-MARI NO. 10, CO-OPERATIVE HOUSING SOCIETY LIMITED, Plot No. 494 HS No. 11, behind St. Joseph Church, Nsoor Road, Mbarara, East, Tange. -401107. The said Flat premises was purchased and owned by the husband of my client **LATE MR. PAUL ARANHA** who expired on 09/08/2011 leaving behind my client **MRS. MARY PAUL ARANHA** and three children namely (1) **PRECILLA ARANHA (DAUGHTER)**, (2) **PREEMROSE ARANHA (DAUGHTER)** & (3) **MR. PRINCE ARANHA (SON)** as his only legal heir or claimants and representative.

Any person's claiming any right, title or claim in respect of the said Flat premises, should intimate me in writing with all documentary evidence, **within 15 days** of publication of this Public Notice, failing which, it will be presumed that there is no right, or claim by anyone and the same has been waived.

Sd/-
ADVOCATE R. M. TIWARI
11, Sanskriti 1, Poonchi, New Market,
Near Abhiyudha Bank, Mira Road, Colaba,
Thane - 401107, Mobile No. : 9820470729

जाहीर नोटीस

या नोटीसद्वारे सर्वसाधारण जनतेने असे कळविण्यात येते की माझे अशिल शी. सिद्धांत शास्त्रात **काकेलुसर कर** आणि शी. शम दत्ताय **काकेलुसर कर** हे 'शास्त्री नारायण सुमूर्तुकी को-ऑप. हौसिंग सोसायटी लिमिटेड', म्हणून ओळखल्याजाणत्या इमारतीच्या, साधव्या मजल्यावरील, ४०/१४ चौ. मी. बांधीय क्षेत्रफळ असलेला, **पलॅट कर** ए/७०१ चे संयुक्त मालक आहेत. जो **मुंबई उपनगर, इमारत १६, १६, शास्त्री नारायण, गोरगाव (पश्चिम), मुंबई - ४०० १०४**, या नोंदीची जिम्हातीली सी.टी.एस. क्र. २२०, गाव - पहाडी गोरगाव (पश्चिम), तालुका - बोरिवली येथे स्थित आहे.

माझे अशिल असे सुचित करत आहे की सोसायटीचे संयुक्त सदस्य म्हणून त्यांच्या नावे **शेअर मधील प्रत्येक कर**. ०२१ ए ५ पूर्ण भरलेले प्रत्येकी ५०/- शेअरस १९९१ ते १९९५ (दोन्ही समावेशी) सीटीएस प्रत्येक विशिष्ट क्रमांकाचे त्यांच्या नावे जारी केले आहेत.

माझे अशिल असे सुचित करत आहे की **हस्तांतरण कर** ए/७०१ या संबंधित **निकाला तेजस नाडकर्णी व सोनानी शाहा काकेलुसर (हस्तांतरण कर)** आणि **सिद्धांत शाहा काकेलुसर व शाम दत्ताय काकेलुसर (हस्तांतरिततेकी)** यांच्यात ५ फेब्रुवारी, २०२१ नोंदीची क्र. वरत- १/१७९३३/२०२१ दिनांक ०५/०२/२०२१ रोजी झालेल्या कारनामाना त्यांच्या ताब्यात नाही किंवा गहाळ झालेला आहे किवा हरवलेले आहे आणि योग्य यादी घेतल्यानंतरही ते सापडले नाहीत.

वरत **पलॅट कर** ए/७०१ हे शाही संबंधित मूळ कारणाच्या किंवा त्याच्या संबंधित अशिल व्यक्ति, बँक, फंड, फंडासह यादी/साक्ष्य असे प्रत्येकी, विविध मालक देवाघेवणे, करार, बक्षीसपत्र, भाडेपत्र, धारणाधिकार, शुल्क, गणपणखत, रद्द, वारसा हक्क, बहिर्बावी किंवा हक्क, आरक्षण, बीजा, देखाबत किंवा इतर, याद्वारे कोणताही यादी/स्वास्थ्य अस्तपत्त्या किंवा ताब्यात असल्यास, त्यांना विनंती आहे की या कारणांना याथे प्रभावित झाल्याच्या तारखेपासून **४४ दिवसांच्या** आत मात खालील नमुद पत्त्यावर त्यासंबंधी योग्य त्या कागद प्रवांशित व पुराव्यासहित संपर्क करावा व तसे करण्यापुढील बाबत व्यक्ती अपयशी झाल्यास सदर व्यक्तीने त्या संबंधीच्या आपला दावा सोडून दिलेला आहे असे समजण्यात येईल.

**सही-
एडवोकेट वितेश आर. भोईर**

१०, सुरंग बावी निवास, स्टेशन रोड, प्रभात हॉटेल लेट समोर.
गोरगाव (पश्चिम), मुंबई - ४०० १०४

मुंबई
दिनांक: १५/०५/२०२५

RESPONSIVE 
We listen. We're responsive.
RESPONSIVE INDUSTRIES LIMITED
CIN No. : L65100MH1982PLC027797
Regd. Office : Village Belagao, Mahagaon Road, Boisar - East, Dist. Palghar - 401 501
Email Id: investor@responsiveindustries.com; Website: www.responsiveindustries.com; Tel No.: 022-66562821; Fax No.: 022-66562798
**EXTRACT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR
THE QUARTER AND FINANCIAL YEAR ENDED MARCH 31, 2025**

Particulars	Quarter Ended		Year Ended	
	31.03.2025	31.12.2024	31.03.2024	31.03.2025
	Audited	Unaudited	Audited	Audited
Total Income from operations	38,216.06	37,048.55	29,719.74	1,42,632.46
Net Profit/(Loss) for the period (before tax, exceptional items)	5,617.16	5,070.35	4,984.90	20,977.80
Net Profit/(Loss) for the period after tax, exceptional items)	5,424.87	4,695.27	4,587.10	19,886.17
Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	5,480.71	5,590.58	4,719.87	21,101.20
Equity Share Capital	2,666.09	2,666.09	2,666.09	2,666.09
Other Equity excluding Revaluation reserve as per Balance Sheet	1,31,872.38	-	1,11,040.43	1,31,872.38
Earnings per share (before extraordinary items) of Re. 1/- each (not annualised):				
(a) Basic	2.03	1.76	1.72	7.46
(b) Diluted	2.03	1.76	1.72	7.46

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED MARCH 31, 2025						
						(Rs. in Lakhs)
Particulars	Quarter Ended			Year Ended		
	31.03.2025	31.12.2024	31.03.2024	31.03.2025	31.03.2024	
	Audited	Unaudited	Audited	Audited	Audited	
Total Income from operations	15,297.90	13,150.20	16,130.73	56,413.84	67,175.03	
Net Profit (Loss) for the period (before tax, exceptional items)	736.52	1,438.93	1,247.95	4,263.76	4,246.12	
Net Profit (Loss) for the period after tax, exceptional items)	544.28	1,063.84	850.14	3,172.18	3,163.22	
Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	549.09	1,063.84	851.32	3,176.99	3,164.40	
Equity Share Capital	2,666.09	2,666.09	2,666.09	2,666.09	2,666.09	
Other Equity excluding Revaluation reserve as per Balance Sheet	92,590.16	-	89,679.78	92,590.16	89,679.78	
Earnings per share (before extraordinary items) of Re. 1/- each (not annualised):						
(a) Basic	0.20	0.40	0.32	1.19	1.19	
(b) Diluted	0.20	0.40	0.32	1.19	1.19	

Note: The above is an extract of the detailed format of Audited Standalone and Consolidated Financial Results for the fourth quarter and year ended March 31, 2025, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Audited Standalone and Consolidated Financial Results for the fourth quarter and year ended March 31, 2025 are available on the Stock Exchanges Websites at www.bseindia.com, www.nseindia.com and on the Company's website at www.responsiveindustries.com.

For Responsive Industries Limited
Mehul Vala
Whole-Time Director & CEO
DIN No. : 08361696

Place : Mumbai
Date : May 14, 2025

WHITE HALL COMMERCIAL COMPANY LIMITED
("Target Company")
 Corporate Identification Number: L51900MH1985PLC035669
 Registered Office: O-402, 4th Floor, Plot No. 389, Palai Ratan House, Sankara Mattham Road, Kings Circle, Matunga, Mumbai - 400 019, Maharashtra, India, **Tel. No.:** +91 22 22020876; **Fax:** NA;
Email: whitehall@yahoo.com **Website:** www.whitehall.co.in

Recommendations of the Committee of Independent Directors (IDC) on the Open Offer to the Shareholders of White Hall Commercial Company Limited (hereinafter referred to as "The Target Company") by Rightful Consultancy Services LLP ("Acquirer") under Regulation 26(7) of SEBI (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011

1.	Date	May 14, 2025
2.	Name of the Target Company (TC)	White Hall Commercial Company Limited
3.	Details of the Offer pertaining to TC	<p>Open offer for the acquisition of up to 64,740 (Sixty Four Thousand Seven Hundred and Forty Only) fully paid-up Equity Shares having a face value of ₹10/- (Rupees Ten only) ("Offer Shares"), representing 26.00% (Twenty-Six Percent) of the total voting share capital of the Target Company on a fully diluted basis, as of the tenth working day from the closure of the tendering period of the open offer, for cash at a price of ₹1/- (Rupee One only) per equity share, from the public shareholders of the Target Company ("Open Offer")</p> <p>The Public Announcement dated February 20, 2025, ("PA Date"), the Detailed Public Statement dated February 27, 2025 ("DPS"), the Draft Letter of Offer dated March 06, 2025 ("DLOF") and the Letter of offer dated May 09, 2025 ("LOF") have been issued by Corpwis Advisors Limited on behalf of the Acquirer.</p>
4.	Name(s) of the acquirer and PAC with the acquirer	<p>Rightful Consultancy Services LLP</p> <p>There are no persons acting in concert (PACs) with the Acquirer for the purposes of the Open Offer.</p>
5.	Name of the Manager to the offer	<p>Corpwis Advisors Private Limited Address: G-07, Ground Floor, The Summit Business Park, Andheri Kurla Road, Behind Guru Nanak Petrol Pump, Andheri East, Chakala MIDC, Mumbai, Maharashtra, India, 400093 Tel No.: +91 22 4972 9990; Fax No.: NA; Email: openoffer.whitehall@corpwis.com; Website: www.corpwis.com; Investor Grievance Email: investors@corpwis.com; SEBI Registration Number: INM000012962; Validity: till 31.01.2028 Contact Person: Nikunj Kanodia</p>
6.	Members of the Committee of Independent Directors (Please indicate the chairperson of the Committee separately) (here after referred as "IDC")	<p>(i) Mr. Nilesh Savant (DIN: 09440936) – Chairperson (ii) Mr. Suresh Argade (DIN: 07945594) - Member</p>
7.	IDC Member's relationship with the TC (Director, Equity shares owned, any other contract /relationship), if any	<p>(i) The members of the IDC are independent directors on the Board of Directors of the Target Company. (ii) Except Mr. Suresh Argade holding 4900 Equity Shares, none of the members of the IDC hold any equity shares or have entered into any contract or have any other relationship with the Target Company.</p>
8.	Trading in the Equity shares/other securities of the TC by IDC Members	None of the IDC Members have traded in any equity shares /other securities of the Company during a period of 12 months prior to the date of Public Announcement and the period from the date of the Public Announcement till the date of this recommendation.
9.	IDC Member's relationship with the acquirer (Director, Equity shares owned, any other contract /relationship), if any.	None of the IDC Members have any relationship with the Acquirer.
10.	Trading in the Equity shares/other securities of the acquirer by IDC Members	Not Applicable
11.	Recommendation on the Open offer, as to whether the offer is fair and reasonable	The IDC is of the opinion that as of the date of this recommendation, the Offer Price of Rs. 1/- (Indian Rupee One) per equity share offered by the Acquirer is (a) in accordance with the regulation prescribed under the SEBI (SAST) Regulations, and (b) the Open Offer appears to be fair and reasonable. Shareholders should independently evaluate the Offer and make an informed decision.
12.	Summary of reasons for recommendation (IDC may also invite attention to any other place, e.g. company's website, where its detailed recommendations along with written advice of the independent adviser, if any can be seen by the shareholder)	<p>The shares of the company are not frequently traded. The current market price is Re 0.20 per share and the open offer price is based on the valuation report submitted by a registered IIBI Valuer. Hence the open offer price of 1 per equity share is fair and reasonable.</p> <p>The statement of recommendation will be available on the website of the company at www.whitehall.co.in.</p>
13.	Disclosure of the Voting Pattern	The recommendations were unanimously approved by the members of IDC.
14.	Details of Independent Advisors, if any.	None
15.	Any other matter(s) to be highlighted	None

To the best of our knowledge and belief, after making proper enquiry, the information contained in or accompanying the statement is in all material respect true and correct and not misleading whether by omission of any information or otherwise and includes all the information required to be disclosed by the Company under the Takeover Code.

For and behalf of The Committee of Independent Directors of
White Hall Commercial Company Limited
Nilesh Savant
Chairperson - Committee of Independent Directors

Place: Mumbai
Date: May 14, 2025

PUBLIC NOTICE

NOTICE is hereby given that, the Property described in Schedule herein below was owned by **Mr. Mahadeo S. Bihare**, and was allotted under Slum Redevelopment Scheme of Government vide letter No -**ACK6 1674/AM-II/Gen** dated **06.06.2017**, the said property situated at **Plot No.102, Bldg. No. B-13, Tahirak-E-Inasr SRAKCS Ltd., Shivshahi Panhwar-Ein SRAKCS, Near Nagari, Vindoshi, Village Malad East, Mumbai-400065** and further said building is registered under the SRA CHSL provision under the Registered No **MUM/SRA/SHS/TC/12651**, dated 2015, the society has issued Share Certificate No-60, Share distinctive Nos. 296 to 300 dated **15/08/2017**, **Mr. Mahadeo S. Bihare** alias **Madhavraj Saloji Bihore** alias **Bihore Madhavraj Saloji Bihore** alias **Bihore Madhav Saloji Bihore** died on **21/01/2023**, and his wife **Mrs. Savitrabai Madhavraj Bihore** also died on **25/09/2007** without making nomination, nor other legal heirs namely (1) **MRS. ASHAMATI CHABURAN YADAV** (release) Son of late **Madhavraj Saloji Bihore** (2) **MR. DADARAO MADHAVRAO BILHORE** (release) Son of late **Madhavraj Saloji Bihore** released their shares in their ancestral property in favor of (3) **MR. KRISHNA MADHAVRAO BILHORE** (release) Son of late **Madhavraj Saloji Bihore** and executed Deed of Release dated **15/01/2024** under serial no-BRL-1/304/2024. Therefore **MR. KRISHNA MADHAVRAO BILHORE** also died on **16.02.2024** without making nomination for the said property, now all legal heirs of Late **MR. KRISHNA MADHAVRAO BILHORE** namely (1) **Mrs. Radha Krishna Bihore** wife of late **MR. KRISHNA MADHAVRAO BILHORE** (2) **Mrs. Maruti Krishna Bihore** Son of late **MR. KRISHNA MADHAVRAO BILHORE** (3) **Mrs. Laxmi Balasabeh Var** daughter of Late **MR. KRISHNA MADHAVRAO BILHORE** intend to release their shares in favor of (4) **Mr. Ram Krishna Bihore** Son of Late **MR. KRISHNA MADHAVRAO BILHORE**. Therefore **Mr. Ram Krishna Bihore** is willing to sell the said flat to prospective buyer i.e. **MRS. SAIRA AKHTAR ANSARI**. Any person having any rights, title, claim or interest in the said property, by way of succession, mortgage, lien, leasing, gift or otherwise, however in respect of same, shall intimate the objection, if any, to the undersigned with supporting documents therein within **15 days** from the date of publication of this notice or else any such claims by anyone shall not be considered and shall be deemed to have been waived and/or abandoned. And, my client shall proceed to conclude the negotiations and no claims shall be entertained thereafter

SUYFAN S. PATHAN (Advocate High Court)
12/02, Chandresh Residency CHS Ltd.
Lodha Complex, Mira Road (E)
Tehsil 401107 Date: 15/05/2025

रोज वाचा दै. 'मुंबई लक्षदीप'

HIKAL

३१ मार्च २०२५ रोजी संपलेल्या तिमाही आणि कालावधीकरिता
लेखापरीक्षित वित्तीय निष्कर्षांचा अहवाल

Registration No. 2424

रु. मिलीयन मध्ये (प्रति समभाग आकडेवारी व्यतिरिक्त)

तपशील	एकत्रित				
	संपलेले तीमाही		संपलेले वर्ष		
	३१-मार्च-२५	३१-डिसें-२४	३१-मार्च-२४	३१-मार्च-२५	३१-मार्च-२४
	लेखापरीक्षित	अलेखापरीक्षित	लेखापरीक्षित	लेखापरीक्षित	लेखापरीक्षित
एकूण महसूल	५,५२९	४,५१३	५,१४६	१८,६४८	१७,८७९
या कालावधीसाठी निव्वळ नफा/(तोटा)/(कर अपवादात्मक आणि/किंवा असाधारण वस्तू पूर्वी)	६८३	२३८	४७३	१,२३८	९५५
या कालावधीसाठी निव्वळ नफा/(तोटा)कर पूर्वी(अपवादात्मक आणि/किंवा असाधारण वस्तू नंतर)	६८३	२३८	४७३	१,२३८	९५५
कालावधीसाठी करानंतरचा निव्वळ नफा/(तोटा)(अपवादात्मक आणि/किंवा असाधारण वस्तू नंतर)	५०३	१७३	३३९	९०८	६९६
कालावधीसाठी एकूण सर्वसमावेशक उत्पन्न कालावधीसाठीचा नफा (करानंतर) आणि					
इतर सर्वसमावेशक उत्पन्न (करानंतर)	४९२	१७१	३३८	८९४	६९०
समभाग भांडवल	२४७	२४७	२४७	२४७	२४७
इतर भांडवल					
उत्पन्न प्रतिभाग (दर्शनीमूल्य रु.२/- प्रत्येकी) (अखंडित आणि खंडित कार्यचलनासाठी)				१२,३७६	११,६३०
- पायामृत	४.०७	१.३९	२.७६	७.३६	५.६४
- सौम्यीकृत	४.०७	१.३९	२.७६	७.३६	५.६४

टीपः
१. कंपनीच्या स्वतंत्र निकालांच्या संदर्भात, रकम खालीलप्रमाणे आहे

तपशील	स्वतंत्रित				
	संपलेले तीमाही		संपलेले वर्ष		
	३१-मार्च-२५	३१-डिसें-२४	३१-मार्च-२४	३१-मार्च-२५	३१-मार्च-२४
	लेखापरीक्षित	अलेखापरीक्षित	लेखापरीक्षित	लेखापरीक्षित	लेखापरीक्षित
एकूण महसूल	५,५२९	४,५१३	५,१४६	१८,६४८	१७,८७९
या कालावधीसाठी निव्वळ नफा/(तोटा)/(कर अपवादात्मक आणि/किंवा असाधारण वस्तू पूर्वी)	६८४	२३९	४७२	१,२३९	९५४
या कालावधीसाठी निव्वळ नफा/(तोटा)कर पूर्वी(अपवादात्मक आणि/किंवा असाधारण वस्तू नंतर)	६८४	२३९	४७२	१,२३९	९५४
कालावधीसाठी करानंतरचा निव्वळ नफा/(तोटा)(अपवादात्मक आणि/किंवा असाधारण वस्तू नंतर)	५०३	१७३	३३८	९०९	६९५
उत्पन्न प्रतिभाग (दर्शनीमूल्य रु.२/- प्रत्येकी)(अखंडित आणि खंडित कार्यचलनासाठी)					
- पायामृत	४.०८	१.४०	२.७५	७.३७	५.६४
- सौम्यीकृत	४.०८	१.४०	२.७५	७.३७	५.६४

२. वरील सेबी (लिस्टिंग)आब्लिगेशन्स अँड डिस्कलॉजर रिकायमेंट्स) रेग्युलेशन, २०१५ च्या नियमन ३३ अंतर्गत स्टॉक एक्सचेंजमध्ये दाखल केलेल्या त्रैमासिक आर्थिक निकालांच्या तपशीलवार स्वरूपाचा उल्लेख आहे. आर्थिक निकालांचे संपूर्ण स्वरूप स्टॉक एक्सचेंजच्या वेबसाइटवर उपलब्ध आहे (www.bseindia.com आणि www.nseindia.com) आणि कंपनीच्या वेबसाइटवर (www.hikal.com) उपलब्ध आहे.

३. सध्याच्या कालावधीच्या सादरीकरणाशी सुसंगत राहण्यासाठी आवश्यक तेथे मागील कालावधीचे आकडे पुन्हा एकत्र केले गेले आहेत.

हायकल लिमिटेडकरिता
सही/
जय हिरेमठ
कार्यकारी अध्यक्ष
डीआयएनः ००६२२०३

स्थळः मुंबई
दिनांकः १४ मे, २०२५


हायकल लिमिटेड

नोंदणीकृत कार्यालयः ७७७/७९८, मेकर चेंबर V, नरिमन पॉइंट, मुंबई - ४०० ०२१.

दूर.क्र. : +९१-२२-६२७००२९६, सीआयएन :एल२४२००/वेबसाइट:९६८/प्रीसीडीसी४०२८,

ई-मेल: info@hikal.com; वेबसाइट: www.hikal.com

Just the right chemistry

<div>  <div> GANESH BENZOPLAST LIMITED CIN : L24200MH1986PLC039836 Regd. Office : Dina Building, 1st Floor, 53, Maharshi Karve Road, Marine Lines (East), Mumbai 400 002. Telefax: 022-22001928 e-mail : investors@gblinfra.com web-site : www.ganeshbenzoplast.com </div> </div>											
Extract Of Statement Of Audited Standalone And Consolidated Financial Results For The Quarter And Year Ended March 31, 2025											
Sr No	Particulars	STANDALONE						CONSOLIDATED			
		Quarter Ended			Year Ended			Quarter Ended		Year Ended	
		31.03.2025	31.12.2024	31.03.2024	31.03.2025	31.03.2024		31.03.2025	31.12.2024	31.03.2024	31.03.2024
		Audited	Unaudited	Audited	Audited	Audited		Audited	Unaudited	Audited	Audited
1	Total Income From Operations	575.57	550.19	602.47	2,154.01	2,267.15		999.34	892.24	1,462.64	4,770.77
2	Net Profit for the period (before tax and Exceptional items)	243.50	212.85	220.52	861.92	815.73		285.85	242.41	208.96	839.91
3	Net Profit for the period (before tax and after Exceptional items)	(200.28)	212.85	220.52	418.14	815.73	(161.46)	242.41	208.96	519.22	839.91
4	Net Profit for the period (after tax and after Exceptional items)	(158.58)	161.48	161.90	307.25	606.25	(131.92)	183.89	142.91	380.86	614.41
5	Total Comprehensive Income for the period	(158.13)	153.46	165.38	300.61	609.47	(131.79)	174.42	146.18	373.97	616.86
6	Equity Share Capital(Face value of Re.1/- each)	71.99	71.99	71.99	71.99	71.99		71.99	71.99	71.99	71.99
7	Reserve excluding Revaluation reserves as shown in the audited balance sheet				5,223.41	4,922.80				5,311.39	4,944.17
8	Earning Per Share (of Re. 1/- each) (not annualised) (after Exceptional items)										
	a) Basic	(2.20)	2.24	2.31	4.27	8.95	(1.83)	2.55		2.03	9.07
	b) Diluted	(2.20)	2.24	2.31	4.27	8.95	(1.83)	2.55		2.03	9.07
Notes: 1 The above is an extract of the detailed format of Financial Results for the Quarter and year ended on March 31, 2025 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results are available on the Company's website , www.ganeshbenzoplast.com and and Stock Exchanges website. www.bseindia.com and www.nseindia.com 2 The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at their meeting held on May 14, 2025.											
						By Order of the Board of Directors For Ganesh Benzoplast Limited Sd/- (Rishi Pilani) Chairman& Managing Director (DIN 00901627)					
PLACE : MUMBAI DATE:- May 14, 2025						